

સ્પંડન  
૨૦૧૭-૧૮



ગુજરાતી સાહિત્ય એકાડેમી

રાષ્ટ્રીય શાયર શ્રી અવેરચંદ મેઘાણી

ઘટમાં ઘોડા થનગાને  
આતમ વિઝે પાંખ,  
અણાદિઠેલી ભોમ પર  
યૌવન માંડે આંખ...



માર્ગદર્શક

મુખપૃષ્ઠ અને

ડૉ. સુધી વ્યાસ  
પ્રા. પીતિ દવી

સુરોમન  
ભવી ગંધી

દુસ્તાલિઝેટ  
‘સાંદન’ નાં  
કાર્યકરી / સંચો

લેખન

સંકલન

કોરમ પરમાર  
માંદી રાહ

રીદ્યાં પોકાર  
વૈનાવી દ્વાહ  
મિતેશ મોજુદી

## પ્રરચારના

કુશી સમીરલાઈ સોમેયા, શ્રીમતી લીલાબેન ડૉડ નયા  
સમર્પણ સોમેયા પરિવારના સતત માર્ગદર્શન લથા પ્રોન્ટસાઇનપી  
સાહિત્ય શિક્ષણની પ્રવૃત્તિઓથી અમારી મજાવિધાલય કુરોતર  
ઉત્સુકીના પંદે આગળ વધતી રહી છે.

વિધાર્થીઓના રડેલી સુષુદ્ધ સાહિત્ય ડાનાને વેગ  
આપવાનું કાર્ય છેલ્લા ૧૪ વર્ષથી હાથ ધર્યું છે. આ કાર્ય એટલે  
હુક્તલિભિત સામાયિક 'રંગદન' નું પ્રકાશન આ વર્ષ ગુજરાતી  
સાહિત્ય મંજુના વિધાર્થીઓએ વિશ્વ ગુજરાતી દિન લથા નર્મદાની  
૧૮૮ મી ૪૫૫૫૫ની અવસરે તેમજ ૨૮ ઓગસ્ટ ૨૦૧૭  
જવેરચંદ નેઘાડીની જન્મનિથિ અવસરે આ વિભયને વળી લઈને  
હુક્તલિભિત સામાયિક તેમજ તૃતીય વર્ષ ડલા વિલાગમાં  
લોકસાહિત્યના વિભયનો સમાવેશ થયેલ ડોપાથી વિધાર્થીઓ અને  
પ્રાધ્યાપકો સમજુ "રાચ્છીય રાયર જવેરચંદ નેઘાડી" અલિયબન  
કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.

કાર્ય લલે એક ડોય પડી દર્કે જ્ઞાના સાથ સહદાર  
વિના ને પૂર્ણ રૂપનું નથી. આ કાર્ય પડી વિધાર્થીઓનાં સાથ હારા  
જ શક્ય જન્યું છે.

ડૉ. સુર્પા વ્યાસ  
પ્રાચાર્ય  
ગુજરાતી વિભાગ અધ્યક્ષા

# અનુકૂમારીકા

---

૧. કાપિ શ્રી ઝવેરચંદ મેઘાંગી

૨. નવલકૃષ્ણાંગ  
શ્રી ઝવેરચંદ મેઘાંગી

૩. લોકસાહિત્યાંગ  
શ્રી ઝવેરચંદ મેઘાંગી

૪. પાંડુંગ  
શ્રી ઝવેરચંદ મેઘાંગી

# ... પરિવર્તા ...

મેઘાણી 'ગુવેચચં' કળિલેદક્ષમનો જન્મ ૧૯૫૭ માં  
વૌથીલા ગામે થયો. સૌરઠની દળની ઘર્ટીનું ઘર્ટીનું ઘાવી ઉછરેલા  
મેઘાણીને ગાંધીજીએ વાધ્યાય કાયર તરીકે નોબરાનીલા. 'સિંધુડી',  
'ચુષંના', 'રેણીજા ફૂલ', 'દ્રિલ્લોલ', 'વંદી', 'કંડાવરી' જેવા  
કાયચંગ્રહી 'વેરિગાળ', 'તુલસીક્યારો', 'સત્યની શીદમાં', 'પુરાતન  
જ્યોતા', 'સૌરઠ તારા રહેતા પાણી' જેવી નવલક્ષ્યા. રૂડીવાનાં વારેમાં  
તેમની સૂસમ જન્મીકાશા શરીરિત, લોદુબોલીનો સમુચ્ચિત નોંજિયોગ જેવી  
ગુજરો નજીરે પડે છે. 'સૈંસાર્થની વસ્તુર', 'સૌરઠી બદ્ધાર્વરીયા (ભાગ  
૧ થી ૩), 'રંગી છે જારીએ', 'દરિયા પારના બદ્ધાર્વરીયા' લોડકથાઓમાં  
મેઘાણીનો સંપાદિત છબકાર જેમાં બદ્ધાર્વરીને બોલકી ઘારદાર ક્ષેત્રીનું  
વસ્તુરીનું બાધ્યાય બનાવે છે. સુહિય શીમે નોંબાર પુરાન, કુરવા  
બદ્ધલ ઈ.સ. ૧૯૭૮ માં મેઘાણીને 'કણાંજિતલામ સુવર્ણચંદ્ર' વ્યાનાયત  
કરાયો હતી. 'માઝાખ્યાઈના દીવા' મસંગ ડથાઓ રવિશાંકુર મદ્વારાજના  
ભામાજ સૌવાના પ્રસ્તુરો દર્શાવનું પ્રેરણ પુસ્તક છે.

# ... કાવ્ય ...

સમયંગનાં જાત્યાની મેદાણી પ્રકાશ્ય રસમજીતા હતા. એ  
ખોમને મારે ખોડ પ્રાપ્ત 'ઘર્મ' હુતે. ખોમડી જાત્યાક્યાનાની શાધુઓથાતની  
બાલ-દિકોરડાયોદી કરી હુલી, જેમાં નવા યુગની ભાતનાચ્છી દાખલ  
કરવાનો મેદાણીનો પ્રવર્તન હત્તે. પણ એ કંઈ સમયંગનાં ડાલો ન  
હતા. પછીએ પણ 'ખોડતારો' ખાના નિવેદનમાં મેદાણી છર્ણાવે છે. તેમ  
ખોમનો વ્યાતિગમ ર-રદ્દા, વ્યાતેરામુક્ત ઘને છે, ખોમની આવલદર્શ ઠંડીક  
જુદુ તકે છે. એને ઝૂલુમ-ગાંસ, કંદી કે ઝનાતન, ભાગોને વ્યાલેખવાની  
એ બાધ લીડે છે. મેદાણી કેવળ સમયંગમાં જાગડોલાહેલા કર્વિ  
કે રસનાતન, સાંજીની વ્યાલેખવાની એ બાધ લીડે છે. મેદાણી કેવળ  
સમયંગમાં જાગડોલાહેલા કર્વિ નથી જ, એ લણમાં રટેવું જોઈએ.  
એ બધા તાતફાલ્યોને જુદા પાડીને જોવાથી મેદાણીને વધુ ન્યાય  
થવા સંભવ છે. એહી રામપ્રસાદ કૃષ્ણ જેવાના લેખમાં એમ જામ  
થયું પણ છે.

મેદાણી લોકાલ્યિમ્યુલ કર્વિ છે. એ લોકાલ્યિમ્યુલતાને ડારણીએ  
લોકગ્રાહ્ય સમતલ ભાવોમાં રમે છે. સંવેદનોની વૈદ્યકિતકતા એને કર્વિતા  
પરતરેની કર્વિની વ્યોકલયાણને રીસરી ગયા છે. ઠંડી દોરા વંગનો  
વ્યાખ્યાત લે છે. વ્યાજનાત્મકતાને રથાને પ્રફર્તના - વ્યાતિદાપરાયણતા એને  
વ્યોકલયાણમાં સરે છે. એને પ્રફર્તાર પણ વધોરે છે. એવી રોકોરો માટી  
થઈ છે. એ નિરાધાર નથી નથા રખીને નિમની લઘાયેલી વ્યાપ્રકિદ્દ  
પ્રથમ હૃતિ તથા 'દીવડો જાણી વણે' એ પ્રકિદ્દ પ્રથમ હૃતિ બ્યતાવે છે.  
કે મેદાણીએ કર્વિનાંથીનો વ્યાંભ તો વંગત રંગેદનની વ્યાતિયાજિથી  
કર્યો છે. એને પણીએ પણ એવાં થીડા જાણો વોમના દૂધે રખાયાં  
કર્યો છે. 'ખોડતારો'ની ઉન્ટું લેખાની હૃતિએ પણ વૈદ્યકિતક રંગેદનની  
સૂમિદા પર ઉભેલી છે. એમ રદ્દીવાચ - એ મુલમાં પરસંવેદન દીય  
તીયે એને પૌતીડા જનાક્યામાં વ્યાખ્યાં છે. પણ હ્યાંયે વ્યાતિયાજિત-  
તશ્છ મારે ભાગે લોકાલ્યિમ્યુલતાની મુદ્રા છે. - એમાં લોકડાળીને

યારળી છંદગુપીની, લોડવાહીની કટાવ્યોનો તથા વ્યાન્ય લોડતત્વીનો વિનિયોગ હૈ, જેમ હૃદાવંદનજાં ડાલ્યોમાં પડુ ગન્યું હૈ.

કુવિતા ક્ષેત્ર સામાજિક ઘટના નથી, ક્ષેત્રી વિષય રૈચનિક સંબોધન જ દોષ કરે વાને કુવિતાનું ભાષાકર્મ પડુ કુવિતાનું વિશિષ્ટ દોષ ક્ષેત્રી વ્યાદ્યનિક સાહિત્યટિકને મેદાહીની કુવિતાથી નિરાળા થાય તો તે કમબદ્ધ ક્ષેત્રું હૈ. પહોં મેદાહીની ક્ષેત્ર સાહિત્યટિક જ ન. દુઃખ તો બન્યું થાય ! કમબ ગાંધાર્યુગમાં આ સાહિત્યટિક પ્રવર્ત્ણે કે જરી ? ગાંધાર્યુ વાને વલબંતબાય ક્ષેત્રી બોલિન પ્રદારનાં વિકિત્વીના જ્વાની વ્યાખ્યા લઈને વાતની ક્ષેત્ર દુઃખની કુવિતામાં કમબાસતિમુખ્યતાની બાબે વિષયપ્રદારનાને વચ્ચાને ભાવપ્રદારનાનો વ્યાખ્યા લીધો. એને સંસ્કૃતવૃત્તનો તથા ક્ષાલ સંસ્કૃતાથ્ય વાનીને રચાને લોકડાલોની તથા લોડવાહીનો વિનિયોગ દોષ. વ્યાદી મેદાહી ક્વર્વાચીન કુવિતાના પ્રતિનિધિ ન ગણાય તો કંઈ ગંદી નથી. પડુ ક્ષેમનું માનસ ક્વર્વાચીન હો. ક્ષેત્રી નોંધ તો લેલી જ જોઈજે વાને મનકુષ્યલાલ જરી ક્ષેત્રી નોંધ લે હૈ.

મેદાહીની વાપ્તિકિદદ્ય પ્રથમ કાય સંસ્કૃત વૃત્તમાં લખેલું હૈ. પછીએ પડુ ક્ષેમની અવારનવાર સંસ્કૃત વૃત્તની ઉપયોગ કર્યો હૈ. ક્ષેમાં જ્યાડ જ્યાણ કરી ગઈ દુઃખ તૌરે સંસ્કૃત વૃત્તો ક્ષેમને બિદ્ધ નથી ક્ષેત્રું નથી. જ્યાંત પાછ તેમજ ઉમાકાંક્ષ જોઈ જેવીને પણ મેદાહીની છંદસિકિદદ્ય દ્યાનાર્દ લાગી હો વાને ક્ષેમની છંદોપદ્ધ ડાબી લાયવાનું જ રાજ્યું દોત તો ક્ષેમાં ક્ષેત્રી ક્ષેત્ર કુલો વ્યાપી કાદ્યા દીન ક્ષેત્રી ક્ષેમની વ્યાલિપ્રાય હૈ.

આ ક્ષાલે જ ક્ષેત્ર દ્યાં રાખ્યું જોઈજે કે મેદાહીની કુવિતા લોડકુવિતા નથી કુત્તિ કરતી કુવિતા હૈ. પડુ ક્ષેત્ર લોડકુવિતા કંઈ પરંપરાએ સંમાર્ચન પામતી જઈ કરી કોતે બિદ્ધ થાય હૈ ક્ષેત્ર મેદાહી સારી કીતે ક્વમજી હો ડોઢિયો પડુ કમબજુ હાડે ક્ષેત્ર વ્યાદ્યની ગાંધાર્યુની વ્યપ્તિથાની સૌદી નિક્ષે મેદાહી હૃત. ક્ષેમ લુલનાત્મક દ્વિતીયી ભલે ડાદીએ, મેદાહીની કેટલી કુવિતા ડોઢિયો કે ક્ષેત્ર પ્રકારનો લોડવર્ણ કમબજુ માડી હાડે ક્ષેત્ર દ્યાં રાખવાનું હોતુ, જેમ ગાંધાર્યુના કેટલાં લાખાણી ડોઢિયા ક્ષેત્ર પહોંચી હાડે ક્ષેત્ર પડુ

બોદ્ધવાનું રહે. મૈધાહીમાં મનૌત્પાત્રો તેમજ વ્યાખ્યાકત ઘણ્ણેમાં શિષ્ટકાર્ય વંસ, વ્યાનિવાર્યપઢો છે. ઇસુ યાદ્યિક વ્યતિષ્ઠે છે. તેમ લિખ જેને લોડ વખ્ચે રહેતું ઘનવા વાદે છે.

મૈધાહીની ડવિતામાં પ્રચારકતા દ્વીવાની ફરિયાદ કેલીઓ વાર જ્વાળાય હે. મૈધાહીની કેલીઓ પસંદગીઓ વધે કેલાડ પથપાતો જૂર હે, જીમણો પોતાને જે વ્યતાવવાનું હે તે દુરીને પહું વ્યતાવ્યું હે પહું કીદું વિચારકથન લાયે જ રહ્યું હે. કૃષ્ણ એ દિલ્લીએ વામપ્રસાદ કૃષ્ણને મૈધાહીની ડવિતા પર પ્રચારની વ્યાખ્યેપ ચાચ હે તે જીઓ હે વ્યેમ લાયું હે તો વણી પ્રતીલા દક્ષમું વસ્તુ નીસીની ડવિતામાં જિબાનની પ્રચારકના ઉત્ત્માસ્તું તત્ત્વ પ્રદાન વણી ગયું હે તારી હે. વ્યાની એ વણે ડવિતામાં કૃષ્ણાણનું તત્ત્વ જ્ઞાન ને?

મૈધાહીનું ડવિત્વ વિન્દુ નૈસર્જિક હે જ્ઞાન? વ્યોક વ્યોવી વાપદ વ્યાખ્યાપાય હે કે મૈધાહીની જરૂરકતા મૌલિક નહીં પહું છિત્વોત્થ હે, વ્યેમની વિનોદી પ્રતિનિર્માણ છાક્ષિત હે, વ્યેમને શોદ્ધે શોદ વ્યાધિરબીજ ની જૂર રહે હે. મુજને જ્વાયું જી વ્યતાવવાની જાક્ષિત મૈધાહીમાં પુષ્ટન હે. પહું વ્યેમના વ્યાનુવાદો તથા વ્યાનુકૃતિ વ્યોને મુડાબલે વ્યેમની જ્વાંતર છુતિઓ નિર્ભળ હે. એ વ્યાખ્યપ્રાચની પરીક્ષાનો બાચો માર્ગ તો એ જ દ્વીળ કાડે છેકેમૈધાહીની જે કંઈ સ્વર્ણેષિત ડવિતા હે વ્યોની જ્વાલાયદી તપાસ ચાચ. વ્યાની વામપ્રસાદ કૃષ્ણલ વધે હેમંત હેમાલેવે એ ઉપક્રમ સ્વાધારીને વ્યોક ડરવા જીનું તામ રહ્યું હે. જીમની નિષ્કર્ષ વ્યોવી હે કે મૈધાહી જ્વાંક્ય પ્રતિલાંસંપન્ન ડવિ હે. વ્યોને વ્યેમનું જ્વાંતર જાય સર્જન મુડાબલે વ્યોદું દ્વીવા છાં વ્યાર્વાદીન રૂગના વ્યોક પ્રભાવવાની ડવિ તરીકે વ્યેમને જ્વાંતર વાપદ કે વ્યોદું હે.

પહું મૈધાહીએ રવીન્દ્રનાણનું જ્વાલાય વ્યાખ્યાદી વ્યાનુભવ્યું હે. પરમ નિષ્કાશી વ્યેમણો રવીન્દ્રનાણની ડવિતાના વ્યાનુવાદો કર્યો હે. વ્યોને પોતાની જરૂર જાક્ષિત શરીર લગાડી હે એ વાત પહું વ્યેરતીજ સાચી હે. રવીન્દ્ર-ડવિતાના મૈધાહીના વ્યાનુવાદો જ કિણાળ હુજુરાની વસ્તુજ સુધી પદ્ધતિની જાચા હે. જીનાભાઈ પરેલ કર્યે હે. તેમ નહીનદાસું પારેખના 'વ્યાધિકૃત' પદ - વ્યાનુવાદો પહું વાપદ રીકૃતિ પામ્યા નથી. તો વ્યાનું ઉદ્ધાર વિન્દુ હે ડવિરંગ મૈશબી.

વ્યાનું કરણ મેદાહીની વ્યાનુવાદપદ્ધતિમાં જ રહેલું માનતું મેછાંશે. વ્યાનુવાદની જુહીચુહી પદ્ધતિઓ દ્વિય છે. વ્યાને દરેક પદ્ધતિમાં ત્રણને ડાંડનું એપ્રાવવાનું થતું દ્વિય છે કે વ્યાને ડવિતા તો વ્યોતો પદ્ધાર્ય હે કે વ્યાનુવાદમાં લુચ થઈ ગયું હૈ. વ્યોમ ક્રીસ્ટે ડસ્ટું હૈ. રાગોરે પોતે કરેતા પોતાની ડવિતાના વંશોભ્ય પદા-ગદા વ્યાનુવાદોમાંથી ઘણાખરા વ્યોમની વૃવિપ્રતિભાને નુકસાન ડરનારાં નીવડા દ્વિય (ભૌલાભાઈ પ્રેલ, ૧, પપર) તો ડવિતાનો વ્યાનુવાદ ડરવાનું ડામ ડેરલું વિક હે વ્યે સમભાર વ્યોલું હૈ.

**મેદાહીની રાજ્યાંશ:** વ્યાનુવાદની પદ્ધતિ કરીડાની નથી -

પદા વ્યાનુવાદમાં વ્યે લક્ષ્ય પણ વ્યોલું દ્વિય હૈ. મૂળનો ભાવ વ્યાનુવાદના ઉરીને પોતાની ગુજરાતની વાદીમાં મુઠવાળો વ્યોમની પ્રયાસ હૈ - વ્યે વ્યાનુવાદ હે વ્યોમ ન લાડો વ્યે બીતે. ડવિતું ફેરફાર વ્યાને ક-વલ્યુ ઉમેરણ કરુંબાની વ્યાને ગુજરાતની કે સૌંદર્યી વાતાવરણની લકીર ઘેંઘવાની દ્રો લીધા હૈ. વ્યોમના વ્યાનુવાદો દ્રાંતરની નભડ પઢ્યોંથી હૈ. વ્યોમહો પદ્ધારણ પણ લોડાળીનું - વ્યાપક ગૈયત્રાને વ્યવડાણ વ્યાપે વ્યોલું - કરીડાર્યું હૈ, મેદાહીની નજર બ્યમફ વ્યુનંદા ડાયરિઝનો નથી, વિશાળ ગુજરાતની સમાજ હૈ. વ્યે જુલી કાડે. વ્યાને પોતીડી લાડો વ્યોવી રૂપે રાગોરની ડવિતાની મુઠવાળી વ્યોમની નેમ હૈ. વ્યોમની વ્યા મેમ પરિપૂર્ણ હૈ વ્યે, વ્યાગિયારેડ મહિનામાં જ 'ક્રવીન્ઝરીલા' ની બીજુ વ્યાવૃત્તિ ડરવાની થબેલી વ્યે મેદાહીને વ્યતારી વ્યાપેલું, મેદાહીની લઘીલું, "કું બંટુંત કુ." (૧, ૩૮૫) વ્યોમને બંટુંત થવાનો વ્યાધિકાર હૈ. વ્યોમ વ્યાપરી પણ કરીડાર્યું મેછાંશે.

**મેદાહીની પોતાની વ્યાનુવાદની પદ્ધતિ રીતાને સમભારી હૈ.** (૧, ૩૮૧ - ૮૫) "વ્યાનુવાદનો વ્યા બાબો પ્રફાર હે" વ્યે વ્યોમની વાત વ્યાપરી નહીં કરીડાશીએ, પણ વ્યાનુવાદનો વ્યા પણ વ્યોર્પ પ્રફાર હૈ. વ્યોમ જૂર કરીડાર્યું મેછાંશે વ્યાને વ્યોનાથી થતા લાલ વ્યાને દ્રાંજ ઘનોનો વ્યાંદજ માંબો મેછાંશે. ભૌલાભાઈ પ્રેલ કરીડારે હૈ કે મેદાહી રાણી ડવિતાના હ્રાંને પામ્યા હૈ. (૧, પપર) જીડે વ્યા પરત્વે પણ વ્યાહીન્દી કરિયાદને વ્યવડાણ નથી વ્યોમ નથી દૈખાતું. વ્યાનુવાદમજાયી, સ્કરતવ્યુષધી કે સભાનપરો વ્યાર્થ

ने विज्ञामा घोरा दैवज्ञान के लिए उचिताना व्यव्याख्या  
व्यौनी घुंगी है। मैथाडी चीड़ा बीलडा अन्य शैये बोकुं लाग्यु है।  
भैड़े सामै टेंखाप दैवज्ञान- उमेंडु मर्मवैद्यक पशु लाजां है। पहा  
व्यात्याक्षील्लोनी मोये वांदी मैथाडीको रहीन्द्रनाथनी इतिहासी छिपाक्षतीनी  
व्यौनी अज्ञान्यात्तीनी व्यौने लयनर्तननी ज्यात नयी हर्ये व्यौनी सामै है।  
(जुआ भीलात्ताई पटेल, १, पाँच) गंगाली 'भासा वस्तुत तत्त्वमप्रधान है।  
मैथाडी तलापडी गुज्जाती वालीने व्याक्षय ले है। जीमां तत्त्वमतामै छांगु  
व्यौहुं व्याज है। भीलात्ताई पटेल इहै है। तेम गुज्जातीमां  
तत्त्वमप्रधाननानी नभुड छहर व्यौही छाक्षय (१, पद१) पहा मैथाडीको  
जै सोठगम्य आव्याप्ति झी भार्या है व्यौमां व्यौह डेखुं उंच बीके व्यौ  
पृष्ठन है। गंगालीना के विविह लयबंध है व्यौनी नभुड रहीवार्कुं  
पहा व्या आव्याप्तमां रिक्षा नयी ज्वास्तुं व्याजे इहैरी हीय तो  
व्यानिवार्य दूनि छी बाडाय। व्यौ उंच व्यायवनारी व्यानुवादनी  
रीति गुही ज हीय।

ਨਮੰਦ ਘੱਣੇ ਇਲਪਤ ਤੇਮਨਾ ਜਮਾਨਾਨਾ ਲੀਡਪ੍ਰਿੰਟ ਕਿਵਿਂਹੀ ਹੈ।  
 ਫਲਾਫ਼ੀ ਘੱਣੇ ਨਾਨਾਲਾਕ ਨੇ ਪਾਣੇ ਕਾਈ ਲੀਡਪ੍ਰਿੰਟ ਤਾਂ ਆਪਕੀ ਹੁੰਦੀ।  
 ਪਰਤੁ ਲੋਡੀਨੇ ਤੇਮਨੀ ਜ ਪਾਂਚਖਾਥਾਂ ਦੁਲਕਮਾਂ ਜੂਨਾਂ ਲੋਡਗਿੱਤੀ ਘੱਣੇ  
 ਨਾਂ ਫੇਗਭਿਤਨਾਂ ਛਾਵੀ ਪੋਤਾਨਾ ਮੀਡਾ ਘੱਣੇ ਕਲਾਕਤਾ ਪ੍ਰਲੰਦ ਘੱਵਾਂਕੇ  
 ਗਾਈ ਬਾਂਸਾਨੀਨੇ ਛੇਤਾ ਕੀ ਮੂਡਨਾਵ ਘੋਟ ਘੱਣੇ ਵਖ਼ਤਿਨੀਂ ਭਰਿ ਤੀ  
 ਮੈਦਾਹੀ ਜ ਥਈ ਗਿਆ। ਘਰਾਂਖਿਨ ਘੁਨਾਂ ਸੇਮਨ੍ਹ ਪੜ ਪੜ ਘੋਟ ਮੈਦਾਹੀ  
 ਜ ਘੋਵਾ ਭਰਿ ਥਈ ਗਿਆ ਜੇਮਦੀ 'ਧੂਅਭਰਿ' ਘੱਣੇ 'ਕਾਲੀਂ ਕਾਲੀ' ਨਾਂ  
 ਪਿਉਂਦੀ ਰੁਮਾਵੀ ਘਾਪੇ ਤੀਵਾ, ਜਨਲਾਨਾ ਭਰਿ ਤਰੀਕੇ ਊਜਮ ਭਰਿਵਾਂ ਬਭਵ੍ਯ  
 ਹੁੰਦੀ ਮੈਦਾਹੀਓਂ ਲੋਭਜੁਫ਼ਨ ਘੱਣੇ ਲੋਡਸ਼ੱਹੂਤਿ ਆਈ ਭਰਿਵਿਨੈ ਭੀਡਾ ਘਾਪੀ।  
 ਤੇਮਨਾ ਮੀਡਾ ਘੱਣੇ ਕਲਾਕਤਾ ਮੈਦਾਂਨੀਂ ਘੱਵਾਂਕੇ ਗੁਣਕਾਤ- ਸੌਰਾਹ੍ਨੀ  
 ਹੀਨ੍ਹੁੰ ਤਰੀਏਂ।

ਮੈਧਾਵੀ ਨਾਗਰਿਕ ਸੀਰੀਜ਼ ਦਾ ਸਾਹਿਤਿਕ ਦਾ। ਜੁਵਾਲ ,  
ਗੁਫਾਂ , ਬਾਡੀ ਅਤੇ ਪਾਛਲਾ ਭੀਜੁ ਲੱਡਨ੍ਹ ਦੀ ਯੋਗ ਮੌਜੂਦ ਹੈ ਅਤੇ ਪਾਣੀ ਵੀ ਲੱਡ  
ਵਾਂਗ ਵਾਲੇ ਆਪਣੇ ਬੀਬੀ ਰੀਤੀ ਵਾਂਗੀਲੀ ਬਾਝੀ ਤੇਜ਼ੀ ਪਹੁੰਚੇ ਰਹੇ। ਮਾਥੇ  
ਤੁਲਾਤਮਕ ਰੀਤੀ ਵਾਂਗੀਲਾਂ ਪੀਟਿਆਂ , ਵਾਂਗੀਂ ਗੇਡਮਾਂ ਤੁੰ ਜੀਤੀ ਰੂੰਧ  
ਰੀਵੀ ਰੀਲਾਂ ਵਿਖਾਏ ਜਾਂਦੀਆਂ , ਪਛਾ ਵਾਨ੍ਹੀ , ਅਵਾਜ਼ ਮੈਦਾ - ਗੱਲੀਂ ਅਤੇ

मंत्र. सौराष्ट्रनी भीड़वा ने वहातपल्यु गर्तन. वादीमां दुष्कर्ती  
तेज ने माधुर्य. विवेद, नम्रता व्याने क्षमान तेमना क्षमतावनां  
ज्ञास लक्षणी. पद्मेशी कारमाल पृष्ठिमा, पहुं उक्त्य भावना  
व्याने उमदा विवाहीनी व्याप्तिव्यज्जिमां दिव्यानी द्युधार दैजाडे.  
लोइद्युद्यनै ह्यमन्यावी मूडे तेवुं व्यान तेमना वक्तुत्वमां दिव्यानी  
पहुं तेनी नाजुडाई ने विवेदशी उपयोग की जहो. सादृत्य,  
वक्तुत्व ने इला लोडोने उच्चे लक्ष ज्ञान मारे थे व्यो व्युद्यायी  
तेमनी व्यावस्वत पूर्वति पैवाहेली दुती

**लूप्शेषु** व्याने यंगानी व्यादित्यनी व्याप्तवाद प्रभीला  
मैदाणीने तलपदा बोरही सादृत्यनी लोइसाहियनी जीघमां  
सौराष्ट्रना गामडे गामडे ज्ञानीव्या व्याने तेमनी मारक्त चारही,  
बाबोटो, भरवाडी, भजनिडी, वावहाद्या भरथरीव्यी, डाहीव्यी,  
घटकी दादीमाल्यी व्याने गृहिणीव्यी पासे लोडीतोनो घमनी घोलावी  
त्यारे ज व्येने जंप वाल्यी. व्या बीते व्येकठी केली लोइक्याच्योमां  
मीठी व्यालवाती ढे, जूना वरवदेवारनी व्यंस्तार क्याव्यी व्याने व्युत्तरविद्यानी  
सौर्य उद्याव्यी ढे. परिष व्युत्तरव्याव्यी ढे. केलीड सुंदर गीतक्याव्यी ढे.  
व्याने व्युत्तराणी केलीड प्रेरण उंडक्याव्यी तेमज व्यंतक्याव्यी पहुं  
ढे. लोडीतोमां क्षीव्यीना। कंडमां पक्षपरायी जलाहेला दुखरड व्याने  
व्याळीतो, क्रुतुगीतो, कुरुक्षेम्भवननां गीतो व्याने प्रेरण डानगोपीनां,  
कीडाणीतो, विनोदाणीतो, प्रेमगीतो, दीतिदूसरीतो, दाम्पत्यगीतो, नववासिनां  
गीतो, व्याने प्रेरण वासडाच्योनो समावेश थाया ढे. उपरांत लग्जगीतो  
व्याने दुरा पहुं ढे. व्यान: क्युरशायी मैदाणीव्यी करेलुं व्या डार्य  
तेमना व्याषुक्षेम्भवननी महून व्यदिष्टक्या ढे. सौराष्ट्रना जमीरवना  
ठितिहसने व्याने तेनी प्रभना व्यालवान व्यक्तित्वने पुनर्जुरित उरवां  
च्यैय लोइसादृत्यना उद्यारक मैदाणीने शके भय है.

**मैदाणीव्यी** बीजुं छयुं न लज्युं हीत तो पहुं तेमना  
व्या महूभाष्ट डार्य तेमनी व्याकालीन डीर्ति व्यापावी हीत.

# ••• નવલક્ષ્યમાં •••

મેઘાણીની ડ્રિવિતાથી નવલક્ષ્યમાં પ્રેવજાતાં વ્યાપ્તો જીવે ક્ષેડ જુદી દુનિયામાં પ્રેવજાતા દીક્ષાચૈ વ્યેમ લગે છે. દિનેશ કોઠારી નોંધે કે તેમ ડ્રિવિતાની ક્રેમ નવલક્ષ્ય 'યુત્ત્વાંના' મારે પ્રયોજિયેલી નથી (૨,પદ્દી) ડ્રિવિતામાં જેણા નારા સંભળાતા ફ્લા તે રહ્યાંત્ર્યપ્રીતિ, વાછ્યુભક્તિ વ્યરે ઇલિનજનવાત્સલ્યના ભાવી અદ્દીં ગૌધરા મારે મદ્દુનત ડ્રખી પડે એવું છે. ડ્રિવિતામાં મુશ્ય ભાવનાઓનાની વ્યાંકેશ ફુલી. અદ્દીં વસ્ત્રસવચ્છવનાં વિવિદ પરિણામો ઉપબ્રમાત્રવાની ક્ષેડ ગંભીર પુયાસ હે. વાટ્ટ્યુધ ભાવર અદ્દી. બસમાજ નિગિષ્ઠ - બ્યમાજમીમાંસદ ઘણે છે. ડ્રિવિતા વ્યાભિચ્છેનીસિ પરતે લોડબાણીનો પ્રયાસ પ્રયાસ વ્યક્ત કરતી હુલી. ક્ષેડિનું તો ઉધાસવરુપ જ પાદ્યાંત્ર્ય છે. વ્યેમે પ્રસંગોપાત્ર લોડવાણી ઘણે લોડસંસારના રિનિયોગ બિવાદ લોડબાણીનું ભાવી કણું ક્રીદું વ્યાનુસંદૂન નથી.

મેઘાણીની ગરા નવલક્ષ્યાની વ્યેતિદ્વારિષ્ઠ હે. બાડીની દ્રોય - રૂપાંતરિત વ્યુદ્ધા ભામાજિક હે. 'નિર્ભજન' વ્યાપણી ત્યાં વ્યાખ્યિલક્ષી કે ટ્યાડિતલક્ષી નવલક્ષ્યાની પ્રથમ ફલારી દ્વીવાનું કદી બાડાય - વ્યેમાં વિવિદ દરનાંથી દ્વીવા છાં ક્રી દરનાંથી કરતાં વ્યેનટ નિર્ભજન પર પડતા વ્યાધાત - પ્રત્યાધાતી વધારે મદ્દુવના હે - દિનેશ કોઠારી , ૨,પદ્દી) તો બીજુ બાજુથી ક્રી પ્રેણપ્રધાન નવલક્ષ્યા પણ ઘણવા ભય છે. લભનભવન વ્યેનું ક્ષેડ 'રાખિક' દર્શન વ્યેમાં રજૂ થયું હે. 'તેવિવાળ' વ્યે 'તુલસીભ્રાત્રી' કુંબભુવનની જૂની-નવી પ્રફાલીવ્યોની વ્યાધામહાને વિષય કરતી નવલક્ષ્યાન્યો હે. રાષ્ટ્રકો નવલક્ષ્યાન્યો વ્યા રીતે મદ્યમાફાય સમાજની કેલીડ પોતીકી બમભ્યાનું વ્યાલેખન કરે છે.

**રૂપાંતરિત નવલક્ષ્યાની** પરસ્થિતિ પણ વ્યેના રિષ્યાને તરફારી થઈ દ્વારા એવું દૈખાય છે. વ્યાધન સિંદ્રીએ પોતે તુલાલક્ષી નથી. વ્યેયલક્ષી નવલક્ષ્ય હે. એની જૈ ક્રી નવલક્ષ્યાની મેઘાણીઓ રૂપાંતરિત કરી ક્રી કોઈ ઉંઝી કોઈની નવલક્ષ્યાની દ્વીવાનું ક્રી પોતે

પણ માનતા નથી. 'સત્યની શૌદ્ધમાં' ના અમાજવાદી વિશ્વાસંબંધી મૈદાફીને વ્યાડકર્યા હો ક્રો સ્પષ્ટ બીતે ક્રમભય વીઠું હૈ. 'ગીડેલાં દ્વાર' પરંતે તો મૈદાફી ક્રીડે હો કે વ્યોમાંનું જારીજીવનની ડારમી વ્યાજિપરીશા બસી પ્રસવરેણાનું આખાતકારડ વ્યાલેખન રહેની વ્યાનુહૃતિ વચ્ચવામાં વધુ ને વધુ વ્યાડકર્ય તત્ત્વ ઘણ્યું હતું. (૧,૧૨) વ્યા વી નવલકથાબ્યો, વ્યામ, સામાજિક વિષયને વ્યર્પો હૈ. 'વ્યાપરાધ' ગરિયલથી વનગ જાય હૈ. વ્યોની ભૂમિકા વ્યર્પો સંબંધના વ્યામાજિક ગુનાની હૈ.

એ વ્યધું વસ્તુર્થયન પરંતે મૈદાફીની નિર્ધારનાની સંક્રિતે છે. વિશ્વનાથ ભર્ટે ડફ્યું છે તે સાચું હૈ કે "મૈદાફીની ડલાંનું મુજય બન વસ્તુસંકલના, માનવવિશ્વિષા તે ચિંતન નથી, પણ વાતાવરણસર્જન હૈ". (૨, પઠ્ર) મૈદાફીની વસ્તુવણાર વારું નથી હોતે, વ્યોમાં ગ્રાધિતતા, વ્યાગ્રંભિત ને વ્યાપ્તાતીતિ - ડરનાં સ્થાનો શૌદ્ધવામાં ઝાજુ મુઠીલી પડે વ્યોલું નથી. મૈદાફીની નવલકથાબ્યોના વ્યાંત તો ઘણીલાર સમીક્ષાડોને વ્યાસ્તોષકારડ લાગા હૈ, નવલકથાની વ્યેડ વ્યુસ્ત વ્યોષ્ટાત્મક વ્યાહૃતિ સિદ્ધ ડરવાને વધું મૈદાફી, પ્રમોદકુમાર પટેલ કહે હૈ તેમ, વોયાર વૃત્તાંતોને સ્પંત્રપડી ઘણિતવામાં વધુ કસ લે હૈ એને વ્યોમની નવલકથાબ્યોના વ્યાસંજ્ય પ્રકઢ્યો વ્યાલગાવ્યાલગા બીતે બેનાં સુરેખ વ્યારે વ્યોકાળું વર્જિઝનાઓનો સુષ્પદ પરિચય વ્યાપી હૈ. (૨, ૪૧) અદ્યે સમીક્ષાડી વ્યવારનગાર વ્યોનાં પુછરણોની જોંદ લેતા પણ દેખાય છે.

વ્યાસ છાં, 'વેવિશાળ', 'તુલસીકયારો' વ્યાને 'વસુંદરાનાં પદ્માં - દવલાં' જેવી નવલકથાબ્યો એના ઉચહિતવના દીરધી ક્રોક્ટરે ગુધિત રહ્યી હૈ. એને એની ગ્રાધિતતાબ્યો ઝાજુ વ્યોડે વ્યાપતી નથી, તો 'સોરઠ', નારાં વહેનાં પાણીમાં તો સંધિકાળનું વ્યેડ વાતાવરણ દર્શાવાનો હેતુ દુષાધી રૂડ લાગતા વૃત્તાંતો પણ વાદ્યા વ્યોમાં ઉષ્ણરક અની પોતાની સાઈકલા સિદ્ધ ડરના વ્યાનુભવાય હૈ. પરંતુ 'પ્રભુ પદ્ધાર્યા' જેવી નવલકથા પરંતે તો યાબાંત જુડ્લને ડુરોંનું પ્રાપ્ત થાય હૈ કે એ "નવલકથા જી" પણ સંસ્કાર - વિત્તાંત્રી એને હૈ. વ્યોમાં "જ્યાની સપુર્ણી, પાત્રપાત્રનાં, પ્રસંગોપ્રસંગનાં

અંગ્રેજીમાં ને વિકાસ, ક્ષમનું બેન્ચસ ટુફન કે ઇતિહસ વીહન્દ નથી." (૨,૨૨૭) અંગ્રેજીનું નવલકદ્યા ખોમાંથી 'ગુજરાતનો જીય' માં ઇતિહસને વકાદાર કટ્ટેવાના પ્રયત્નને કારણે મેયાળી, દુનાની પાદાનની પૂરનો રિપોર્ટ ખાતી લાગ્યા નથી એવી ઇન્ડાફાંત ક્રિયાની વાતિલ્પાય હૈ. (૨, ૮૮-૮૯), તો 'સમરંગણ' વ્યાને 'રા' 'ગંગાજિલ્યો' ઉંટ છાયાબ્ધીનો ઘણો વદ્દો વાયુયા લઈ અંગ્રેજીનું પાસ્તરને મૂર્ત ઝરવામાં ઉદ્દીપ્તિ પ્રમોદશુમાર પેટને લાગી હૈ. (૨, ૨૩-૨૪), વ્યા નિર્જિષ્ટાનો નિવાદાર હૈ. એમ નથી ઉદ્દીપ્ત રાણ્ય.

મૈદાદિલ્લી કુલ તેર નવલકદ્યાઓ લાખી હૈ. અંગ્રેજિન લેખક વ્યાન સિંગલેરની 'કૌમયુબલ દ ક્રીડર' નામની રથાના મુજય વૃત્તાત્મકી વાદાર લઈ ૧૮૬૨ માં મૈદાદિલ્લી 'સત્યની કૌદમા' નવલકદ્યા એચી. નવલકદ્યા લિખનનો તેમની પ્રથમ પ્રયત્ન તે વ્યા રૂપાંતરિત નવલકદ્યા. કિલ્લુલ મૌલિક વ્યાન કરતાર ડયાવસ્તુ લઈને તેમણે ૧૮૬૭ માં 'નિરંજન' નામે પ્રથમ સામાજિક નવલકદ્યા લાખી. એ કથાના પ્રકાશન પછી ૧૮૭૭ થી ૧૮૯૭ ના સત્તે વર્ષના ગાનામાં 'કોર્ડ, તારાં વહેતાં પાણી', 'કસુંદરામા રહ્યાંદાં દવલાં', 'વ્યાપરાધા', 'સમરંગણ', 'રા', 'ગંગાજિલ્યો', 'ક્રિકેલાં કાર', 'હેવિશાન', 'તુલસી-દ્વારી', 'ગુજરાતનો જીય ભારી' વ્યાને વિષાને 'પૂલુ પદ્ધાર્યો' - એ નવલકદ્યાઓ તેમણે પુંગર કરી. ૧૮૭૭ માં 'ઉભિ' મારે તેઓ 'કાળાચ્છ' નો વ્યાર્થી હરે હૈ. કમનસીલી, તેમના વ્યક્તાન વ્યવસાનને કારણે એ હૃતિ વાધ્યુરી જ રહી જવા પામી હૈ.

# ••• લોડસાહિત્ય •••

મૈં પાડીના લોડસાહિત્ય વિષયનું જાર્યાનું ખરું, મુંકું મૂલ્યાંકન.  
કરવામાં કેરળીકું મુલ્યાંકની છે. વ્યાપકી પાસે વ્યાતે છે તે એવી મુદ્રિત પાડ.  
વ્યાપકી ની વ્યેને વ્યાધારે મૈં દ્યાડીના જાર્યાને ગૂણવોલી, પડા મૈં દ્યાડીને વ્યા  
ક્ષામગ્રી કેવી રાખકપરૂષી ને કેવા ઉદ્ઘોષી, લોડસાહિત્ય વ્યાચે કેવા રામનાર  
ઘરને વ્યાને બીજાનાં દુઃખપાર જીલવાની કેવી નૈસર્જિક વ્યાવહારથી લેંગી  
કરો છે વ્યેન જકીયે ન્યાં જુદી મેઘાંતા જાર્યાનું મૂલ્યાંકન વાદ્યાનું જ  
રહ્યું છે. અદલાડ્યા મૈં દ્યાડીયે પીતાની પ્રવાસક્રિયાઓ વ્યાપી ટંચાડાપોથી તાં પાતાં  
વ્યાપકી રામકું ખુલ્લાં હુણ્ણી, ને છડાં ની દું પડા વ્યાપકાંગિન છે. વ્યા  
પ્રકાનોંયે મૈં દ્યાડીના જાર્યાને વ્યેના વ્યોક્કસ પરિપ્રેક્ટિયમાં ભૂડવામાં હોય  
મૈં દ્યાડીના જાર્યાની વિશીળતા પારખવામાં ઘડી ઝાંખાય કરી છે વ્યેમાં એડા  
નથી.

મૈં દ્યાડીના લોડસાહિત્યવિષયક જાર્યાનું હોડ વિલફાડ પાણું છે  
ઓમદો રાવકુંસે કરેલો જીની પ્રત્યક્ષા રાશુદ્યાન. લોડસાહિત્ય-પબંગાડક પાસે વ્યા  
જાપેનીત નથી હુંનું જીને રાશુકાનની ડળ કુંઠી જે નો ઘડી વિરલ વાનુ  
છે. મૈં દ્યાડીની વ્યાપિકાઈ કાર્નિની વિકાસ પ્રભમાં લોડસાહિત્યને - લોડ.  
બ્યેન્સન્સાં જીલિજના જીને રસ કેળવણાનું હોડ ઘડું મોંડું ડામ કર્યું છે. વ્યા  
દુડોકની લાવખૂર્દ હોડ જીલુંલાવખૂર્દ રાશ નોંધ તેવાયેલી છે. પડા  
દુલંદિયી મૈં દ્યાડીની પ્રત્યક્ષા રાશુકાનોમાં દ્વાનિ ગુડ્ઝો આસ ફોટ્ટ નથી.  
ઓરટે એમનો રાશુકાનની ડળાં વિરલેફડા-વિવિધનની જ્ઞામગ્રી ઉપલબ્ધ  
નથી. ઓરટે એમનો રાશુકાનની ડળાં વિરલેફડા-વિવિધનની જ્ઞામગ્રી  
ઉપલબ્ધ નથી જીને કર્યાય.

લોડસાહિત્યના જાંગ્યાનું જાર્યામાં મૈં દ્યાડી કરે હોદ્દથી પ્રેવશ્યા કે  
જી જરાબદ લક્ષ્યમાં તે જોયે તી વ્યેમને જીનાયા ધરાની બંન્ધાય  
રહ્યે છે. જી વ્યા ડીગમાં વિલફાડાનું હોદ્દથી પ્રેવશ્યા નથી. વ્યેમનું

प्रयोग व्यापक अनुभव संकेतकरणीय. परिवर्तन सम्भवा-करावानु  
द्दु. विचारापूर्वी मेंदारीने 'सांड-प्रधार' बोली में एक विकल्पीतार्थ करा  
दी. ने या व्यापक घटना व्याख्या की. विकासी प्रभवों विशेष नीतिसाहित्य  
वाले विभिन्न प्रतिक्रिया घटा अनुभव संकारणवाला परिवर्तन  
पढ़ीव्याडवानु डाम लोडव्याडवानु विप्रादनां परा अनुभव संकारण-  
ग्रनना परिवर्तन पढ़ीव्याडवानु डाम लोडव्याडवानु विप्रादनां युक्त वास्तीय  
घोरकीने विगताधी लाग्ये ॥ परा बोली. मेंदारी पासौं दृष्टिमें  
वास्तीय घोरकीने विगताधी लाग्ये ॥ परा बोली. पौत्री ज्ञानग्रीति  
लोडलोड्य रहे शू करवानी उठी व्येष्टी छोड़ी नयी व्येष्टी लाव दी.  
व्येष्टी यो उपरिकाम बोला दीलाय व्यापे ॥

में धारीने लोडभाइट्पर्फिल्म व्हस्टर ब्रूनिन लायामां लैवानु, जम व्हितुं छ. व्हरीं पुछर व्हैट्सर्डर को डाम बैक्सप्रमां पडा उचित परि-

ਕੁਝ ਥੀ ਜਾਇਆਂਦਾ ਹੈ ਪਾਰ ਪਾਇਆ ਹੈ। ਪਤੇ ਮੌਦਾਡੀ ਨੇ ਜਾ ਪ੍ਰਵਾਨਿ ਤੋਂ ਉਦਾ ਉਦਾ ਰਿਵਲਾਗੀਨਾ ਪੜ੍ਹੀ ਉਦਾ ਉਦਾ ਹੈ। ਜਾਨ ਦੋ ਉਦਾ ਉਦਾ ਰਿਚਾਰਡ ਮੈਡਕ। ਮੌਦਾਡੀ ਅੱਪਟਾਈ ਲੋਕਸਾਈਤਿਧਾਰੀ ਵਧਾਰੇ ਲੋਕਫਿਲੀ ਲੋਕਾਂ ਨੇ ਰਿਵਲਾਗੀਨ ਰਿਚਾਰਡ ਹੈ।

‘रसदार’ उपायों, लडाक्यरिपा-लडाक्यों, संतरिशों, डोळीमा-१६८  
जारोंटने वार्नोंको ज्ञान व्रतउपायोंना क्यमावर थाए छ. तो यहां पाया  
ना पुङ्क व्यू ऊमी थाए छ. तो या ज्ञा ‘लौकिकपायों’ उद्याय घरी?

દુસ્તુલાં પરિત્તાડે લોકથાની વિલાયતના રૂપદર કરી, જ્ઞામાંથી કરી શુદ્ધ લોકથા છે, કરી મીતડાણાડયા કે હંતથા છે, કરી બનિપ્રાડયા છે ને બનાવી જ્ઞાયું છે. કૃષ્ણ અંદરવાકર્દે એક જ્ઞા ડ્યાલ્સીનું પોતાની રીત હોય કરીનું હોય છે. મુખાડી પીતે પડો જ્ઞા જદો શુદ્ધ લોકથાઓ કુઠાનું માનતા રહ્યાતા રહ્યો. 'જ્ઞાધાર' ડ્યાલ્સી, જડારવટિયા-ડ્યાલ્સી જ્ઞાન કંતબ્યારિશ્નોને જે લોકથા ઉરનાં વધારે નો મીતડાણ ને જ્ઞાનિદ્ધારાં નરોડે જોગયાએ છે.

“એવાં નરક જીવનથી ચ. એણાં જારોટો લાડકથાંથી પરતે મેઘાડી વડી છે કું એ  
“જીવનની લાખમાં કંઈ મળેલ છે તે જીવનની લાખાની વાડાની  
મુડવાની મારી દીર્ઘ રડી છે” પણ કાંઈ દવાનગૃહદાયાંદીની જાહાયથી

જાંકારીધન ને વૈસાનિક વ્યક્તિગતથી પ્રાપ્ત જ્ઞામગ્રહીને વ્યાલેદરપે જુદ્દે છે ન  
મેંઘાડીએ ન ર ચચ્ચ કાડું દુંયે એ જ્ઞામગ્રહ વ્યક્તિનું છે. નોંધો જ્ઞાને રોચકાઓ  
નથી એ રોચકારાગત - ભાષાભાગત જ્ઞાની બોલની ઝોડપતા રૂપો જુદ્દો  
તથી ગાય ત્યાં જુદ્દો હો જઈ કાડે. ડયાલોને પોતાનું જ્ઞાનાન ઇન્ફોરેમાન  
ન જ્ઞાનું દીયો, ગુણની લગભગ નાનું કર્કિવાનું પણું દીયો નીચે વાડીંતડી  
પરાંદગી, બોઠવકડી ન ભાષાંકંગમાર્ગતની જ્ઞાનાં લેવાની થાં ર દીયો.

જ્ઞાન, જ્ઞાન ડયાલોમાં લોડ-તર્ફ એને મેંઘાડીને રોચાનું જીજીકા  
હી. એ એંનું કેરનું છે એ તપાસની મૌખી રીપણ છે. એ કદવા માટેના જ્ઞાન,  
જ્ઞાન કેરના પ્રાચ્ય છે વ્યાંવો પુષ્ટ જરૂર પછી કાડે, પસ એ, જીગના  
ગોડાફારો કેરનું કરી પડો કાડે, અથી જાંશોદફકૃતિની જ્ઞાની પડો કાડે,  
પડો દૂંખાપ છુંકું કોપડા રિચેચનો જ્ઞાન ડયાલોના કવ ઇપનિર્ણય પરંતુ  
નીરલો આગ ડોલ્યા છે. એટાંને જોની જ્ઞામગ્રહીને જ્ઞાનિક જાણીની માર્ગ  
ડોલ્યા નથી. પુષ્ટ વંદરવાકને જાસ્ત ઉરીને પોતાના જગત્કરણની રોચામાં  
દાખલાયો જ્ઞાન લોડકથાયોની જ્ઞામગ્રહીને તપાસની હેઠળ 'રસદાર'  
ડયાલોના કેરલાં બોલેલોં પડો તારવી જનલ્યાં છે, એંત ગાડીને  
'રસદાર' માંના મેંઘાડીના જાર્ગુડમનું જ્ઞાનથી બનતાવવાની કોઈ  
કોરોલા ઉરી છે. જેને દુલાર પુંઝ વાનાંને પોતાની ભજાણાસીએ મેંઘાડી.  
ડયાલોની કર્કિની જેને લંઘડો પર કેરલાંડ પ્રકાર પાડ્યા છે. પડો જ્ઞાન  
રોચામાં જ્ઞાન ગ્રંથોના જ્ઞાનન જાતલ્યાં - જ્ઞાનારિત વિસ્તૃત પ્રયાસો થવા  
દ્વારા લાડી છે. એનેકા કાર્યકૃતિની પામેતો 'રસદાર'- ડયાલોને તો જીમાં  
થાપીલા જુદ્દારાવદારાની રૂપિક્રિયા તપાસનવાને પડો જ્ઞાનવડાના છે.

જ્ઞાન નિયંત્રીનો ડેનીમા- દાદાજીની વાતોને જાતકથાયોની લરીડ ગુલાબી  
હું એને મનજુખ જાતલાંને દાદાજી-ભારોટીની વાતોને શિંટ્યાવાંધાનની રૂપિક્રિયા  
તપાસની છે, પડો જોમનો કોલગમ કોંદરે જાડુંયાનીઝાનો છે, મેંઘાડીના  
અંપાદન- જાર્ગુ- જમેને જાતલાં પાડીને જોખાવાવવાની નડી.

જ્ઞાન ડયાલોમાંના ગૂલ્યાલોંદની વિચાર કાઢ કાડે? રૂપું પછી  
કોઈ, કેમકે જ્ઞાન જ્ઞામાર્ગિને દુલારવાજો છે. પડો જોની વિચાર ગુંદભાય  
ન જાડીલાવથી નડી, તેમ કોપડા પુરણા ગૂલ્યોની જાલિગ્રહ જ્ઞાન

तर्हि पड़ा नहीं, पड़ा तरक्ष वृत्तानिक कुट्टीची थोड़ी थी. मुनिकुमार लड़े जटारवटांना नीतिवाचकाने जगालर तपास्यु दे पड़ा वो ? माने हो कि "ठीक जुआरवटियां गुवनवरिती दीवां पड़ा दृष्टियां वांखवा. विचारवा घीर्य दीवा ती ते डेवल नीतिक होइ न छे, न होइ इत्यायनां जद्या वाख्यां वाले तो अना कैवल व्यपक छे." व्यो जगालर न पी. व्यो कंडुवित होइ छे. व्येत व्या मुकारना क्लाइट्या विकाप प्रयोजनानी व्येमां व्यवहारकर्ता थाय छ.

प्रलुब्धास इक्के 'वसधार' ने जटारवटिया-इयावाई भूत्यजीदनी होइ व्यो जरा तीकुडानाथी तपास्यी छे. व्यो तपासर व्योपकी छे. छतां घोटी हे व्येम आउपरी र इक्कीवाय व्येमुँ छे, परंतु व्यो गांधारुगां, वाटुकाळिस मुहैयोतो व्यालिग्रह तर्हि व्यात्या छे ते तो आँकुर र थाँकुर छे. विचवनाथ लड़े व्यो प्राव्यीन भूत्यजगतानी नार्यादाव्या दकार्यवा छतां व्येमांधी व्या युगी पड़ा प्रेरणा लेवा शेंकु इशुंक छे. तेम जताथ्युँ छे. ते व्यवहार व्यालिग्रहम इक्कीवाय.

**५. ब्रह्मतः:** का उथाव्यो र नहीं, मीधाडीना व्यापकी कामङ्गु घरेलुँ व्याधुं लोडमाटु-य छीतदुक्या- क्षमार्यार्यानी दिव्यके घारा व्याज्यासां नीतरे व्येमुँ छे. अहीं तो व्यभ आवा पूरकां व्येकले नानकडा तील लाने र यमलत परमाननी मीधाडीना गोलवाराडकर्णन विचाला तपासरनी तील व्यो ज्यमलतना- तथा दुई र व्यांगदमा निरीकुडा छे. व्या यांगी मीधाडीना भूवकां व्यो याच्याता व्यिवाय व्यापकी पासे इक्कु नपी व्येम इक्कीवाय. मीधाडी भजाता हुता हो "डेवल व्या उथाव्योमांधी नहीं पड़ा ज्वा, लेज्वा, व्यती, मर्मलाभिती, शीतलिकाभी, उतारारीगाची, इत्यादि व्याडीत्य तेमां गुवननां तमाम व्यंगोनी छडावरपी र कोऱडी अंकुरनगा गुडादीधनु नवनीत वलीवी व्याडाय." व्येवा व्यो इत्याना मनोरथ व्येमने हुता. पड़ा दुर्लभ्यां व्यो पार पड्यो नपी.

मीधाडीनांपाइन लोडमाटु-यनी जरी व्यामी आ लोडमाटु-या व्याने मीधाडीना भंपादन उर्मगा लेंदलमां थाय ते र गाडाय. 'लोडमाटु-य' ने व्याने 'लोडवारुमाय' व्यांगा व्यादर व्येम गाडाती दीवा न्यां व्येनी

સ્ક્રાન્ડિયન બસેજાનું મદુલ ઉત્તરનું ગણાય. પણ મેધારી જોખાઈન  
લોકસાહિત્યની કામીજા લોકવિદ્યાના વાતે મેધારીના અન્પાદન ડર્મ રંગની  
માં કરવા માર્ગે જામીજુડ લોકવિદ્યાના વાળયાસી દુઓ જીવન, લોકવિ-  
મધ્યનો વાતો પોતાની જારો વાતો પરિવાર દુઓ જીવનો વાતો મેધારી  
નીવી ઉદ્ઘાસીલતા પડી દુઓ જીવનો. મેધારીની જામીજા કરવા, કરી કુ,  
કરી કું વાતો મેધારી નીવી ઉદ્ઘાસીલતા દુઓ જીવનો. જોપડો ત્યા.

લોકવિદ્યાના જગતાર વાતે લોકવાદમધ્યની નિરદની પરિવ્યય દરાંખનાર, માડાનું  
દુના વાતો વાખી પડી છે. પરંતુ વાત જગતારીને પરિવ્યયની જાલી છે  
સીતે પૃથ્વીની વાતે પૂરી ઉદ્ઘાસીલતાથી જામીજા કરવાનું જરૂર નથી એ  
દુડીકાત છે. વસ્તું કોઈ કાર્યક્રમ જામીજાને કષાતે વાપરલાં આપણોન  
વાતો મુખ્યાંદન કરવાનું જોપડાન. વધારે ઠામે હોને શાંતે હો. જોમાં  
રાફુલપટો વસ્તું કોઈ કાર્યક્રમ નિર્જીજાની જુથાઈ ગય તેનાથી જોપડા?  
અંતીમ માનવાની કરી છે.

'ભારતી' જીતકથાબો, માર્ગે 'ગીતકથા', વી જોગાનું સ્ક્રાન્ડિયન  
અભાર્ય-પદ જી વૈદું રણાય છે. કુલું પાણીની જરૂર કરી છે કુંડા-  
સૌરઠા વી કે 'ગીત' કરીવાય નથી. કુંડા વાતે કુંડાનંદ ઉધાલાના  
જામાવકાં લોકપાલીમાં થાય, લોકગીતમાં નથી". પડી વાત ગીતકથા  
કુંડાનીથી કે/ જાંંગબુગડથા જાતી નથી, વીજા, ઝીંઠ કરવાની,  
કડીની જીડવાની રહ્યી છે. વીજે લોકપાલ કેમ કરીવાય? વીજી જથના નથી,  
વીજોં ઝીંઠ કરવાની, કડીની જીડવાની રહ્યી છે વીજી જથના જાંંગબુગ  
પદ્ધરપે ઘર/ નથી તો વી ગીતકથા નથી તો પદ્ધ-કથા પડી કેમ કરીવાય?  
વી 'કંડો' ની જોયે વીજે કેળ મુડી જાડાય? વી તો હી અપાદધનના  
ભીજિય લાગડાં છૂટાં જાયનાંદી. વૈદું કષ્વકરપ વિનિયાર છે. પ્રસંગ  
રંદિલત મુજાહ નીવી વાત જથનાંદી હો. વીજે જાતે કોઈ કુંડા જ  
ની ઉલ્લાસ કરી જીવનો વૈદું લાગે.

ભારતી જાંંગબુગ વી જીતકથાબી ચખિસુત જથનાંદી દુઓ  
ચુબત વાતોનું લોકસાહિત્ય ન કરીવાય. વી મેધારીના દ્યાન જડાર  
કરીવાનું જગાનું કરી નથી. 'ઝુટુગીતી' ની જીવાસી જારડી ગણુગીતી

અને લોડકાર્ડિએટનાં સ્ટુડીલા તુદી પડ્યાં રહ્યી. 'બારડું હોઈ બારડી બારડી' જીવિતન્ય, જો ગુંગ લખનાર એકિત બારડી બારડીની વેલ બાલાઘી બચતંશ પર્સપરાછે કો કમજૂરી રહ્યીએ. પરા બારડી બારડીની બારડી બંધણી કો લોડકાર્ડિય ન ડીય તીથી લોડકાર્ડને બારડી છે. લોડકિફાળા બારડીનું છે. જોથી લોડકાર્ડિયનું ડામ ઉરનારે બારડી બારડીની બારડીનાં કે બંનાઓનીમાં પગાંશારી ઉરવાની ધાર તો જોમાં જવાદ નથી. કે બંને મૈંદાડી તો લોડકાર્ડિયના બારડીના બારડીનાં નંધાઈ રહ્યી નથી, કે લોડકિફાળા બારડીન પરમાં ધૂમતારું છે.

પૌત્રાની લોડકાર્ડિય પ્રદેશીની રૂફર બારડી-પલકી હોઈ રહ્યોટેજી છે. જોમ મૈંદાડી પીતે રહ્યી છે. અને કો વિવેચની પરા બારડી. નજી, બરાલકી કુલિવાની પદ્ધતી ધાર જ્ઞાપણા પર પાડી છે. પરંતુ મૈંદાડી ની બારડીયદ્વારે બારડી નકૃતી જોમાં ભરપૂર જુવનલાંજાના બામાયેલી રૂતી. જોમના લોડકાર્ડિય નબજીના બારડીબાળના મૂલમાં લોડકુવન, લોડ - એન્ટિફાસ હોને લોડકાર્ડારી તરફ બાનુસારું પડીલો રૂતી. રહાનું: દ્યાનથી મેરાંની તો રૂંખાય રહ્યું હોડું મૈંદાડીની કો બનીઝાંની બારડીયદરી જરૂરાં વધારે તો જુવનલકી છે. પૌત્રાની કડારવરામીમાંની બંનંદી મૈંદાડી રહ્યું હોડી કો બારડીયદરી નકૃતી. જુવનના મૂલપાંડની રૂફરી ધરીલી છે. કે જોમની જદી લોડકાર્ડિ-પોર્ટફેચનાને રહ્યું હોડી નાનું પર્દી જોમ છે. મૈંદાડી કો સાદેખાનાં રૂંખાંબાસણી કું બામાઝબાસણીની કુંબાધનથી પ્રબંધી નથી, તેમ છતો જોમાં જુવનમીમાંના કું બસ્કાઝીમાંનાની, જદી બે - નોંધીર રૂપી પરા કેરતો જદી બાનુસી પડી છે. કે તરફ બારડી બંને કાંકારોલી દ્યાન દોદું છે. જોમની વાલિપ્રાય તો જોમાં હોડી કું બારડી, બસ્કાઝ કોબે એન્ટિફાસની રૂફરીની મૈંદાડીની કું નિરીઝાંની રૂપી છે. તેમાં પઢીલી જદું કોઈ ઉનેરડા રહ્યું છે. નાનું હોડી મૈંદાડીની કો વિવેચનાની ની, જોમાં વાનિવાધિસી વાંદીની પુરબાવર્તની કો પ્રસ્તાર રાખી ને. સિલ્વયલકી રૂફરીની બંકિલિન ડરીને મૂલવામાં વાંદી ની મૈંદાડીની લોડકાર્ડિયસનીઝાની વધાર્ય હોને ઉદ્દેનાડ એલી ધાર, જું જાગળના ડામ મારોની હોડ બાદ્યાર લૂભિકા જો રહ્યું.

બીજું, મેઘાજી અ-વીજારે હું કુદરતની વીજારના પ્રથમ  
લોડકારું-પદર્થકારનમાં સુધ્યાત્મા કુદરત હૈ, તેમ મેઘાજીમાં પડા હુંઠી ર. પડા  
મેઘાજીનાં નિરીદની જગતી વીજું હૈ એ ઘણા સગૃહ કર્યા હૈ, પદીલી  
ટીશાલીની દ્યાનમાં તેતા કર્યા હૈ કાંઈ પીતાનાં નિરસણાં તથા બાળિફ્રાયીને  
સુધ્યાત્મા કર્યા હૈ, કોઈ કાંઈ નેરતી પરિપદ્ધતિનાં કેવી હંગતા કર્યા હૈ.  
મેઘાજીએ વોમની લોડકારું-પદર્થકારન, બર્સડારદર્થકારન અને મૂલ્યદર્થકારનનું  
પતા ગાયેતા કંમારીન જ્ઞાન ખૂબં વિષ જ્ઞાન્પદ્દ ને બીજાં પડા જનવા  
કાંલથ હૈ.

# ... પ્રકાશ ...

પ્રાકારત્વ મેદારો નું કાર્યક્રમ છ નહીં, જોમના વ્યાદુંથું એડ ક્રાંતિં મદુલ્યથું પેરક્રોષ્ટ પરિણામ છે. મેદારોની લોકબાનુંથણ અંગોદન-સંપાદનની અંશે સ્વતંત્ર લોખનની પ્રદીપ પણડારી વ્યવસ્થાયની વીજે પંગરો છે. કોઈને જુદી કે પજડારી વ્યવસ્થાયની ઘડકો ન હોય તો મેદારો વામાંથી કેરણું કરી બાક્યા કુટીત તે નિવારિ વિગતનાથ લર્ડ રેવાને સંચોય થાય છે. માકાબ્યના વ્યાદુંથણનું છ નહીં, જોના ગુવનનું વ્યક્તિ કોઈની કોઈ નિમિત્તથી બાડા લેતું કુચ્ચા છે. કોઈને બાબાં બાળુમાનાં તારકાં જુદી પદ્ધિયાનું બ્રાલાયિક છે. પડી વૈકોને જરૂરી બીજેં નિમિત્તી મળી રહ્યાની બાડયના લકારી ન કાગાય બને વંતે માડાબની છે - ની અધ્યાત્માં મૂળિયાં ની વૈની પ્રદીપમાં વૈની ભાગગીરીની ગુજાવના, જોની વ્યક્ત અની વૈની જુમતા બને છે - ન નિમિત્તાની વૈની કરેલા લાલ-ગેરલાલની જામીજીા કરવી કોઈ કાર્યક્રમ નને. જીની મારી જ્ઞાપડારી પારી નક્કર બામગ્રી છે જેમ પડા કર્યાય.

મેદારોની પજડારપ્રદીપાતની જામીજીા કરવાનું જામ દાઢું વાધું છે, કેમ કે જેમાં જેડથી વધુ પારયા છે. કરા પાણીં જ્ઞાપડા તુંદાં પાડી જાડી ક્રી. એડ, વૃનપજાની ભાગગીરી. જરા વાર્ષિમાં પજડારત્વ ને જીની જ કર્યાય. મેદારોને લીલાવવામાં જ્ઞાયા કુતા એડ વૃનપજાની જ્ઞાયા વ્યાતાવવા પડા વૃનપજારત્વથી જે જ્ઞાનો બદી જ્ઞાયા નથી એવે તંત્ત્રીની જ્વાલણારીનું વદન કરવાનું પડા વૈમળી જ્ઞાયું છે. વૃનપજારત્વથી જે જ્ઞાનો બદી જ્ઞાયા નથી. વૃનપજારત્વ કોઈને જ્ઞાયનાં જોંડીલની જીતનાં, જોંઝનાં એવે વૈની જામીજીા કરવી. લીનું પાણું ને જાનાંકી જેની જ્વાલણી જામગ્રી જીરણો લોકડેવવડીનું - લીડરુંબના ઘડતરનું પડા - જામ કરવાનું ને. જ્ઞા પાણામાં પજડારની જ્ઞાયે વ્યાદુંથણ જીડાય છે. જીનું પાણું છે પરીનાં પાણો પર રજુ થયેલી વ્યાદુંથણ.

પાણાં પાણાં પર રહ્યું પદીત દીવાચી વાતે વાપડી પગડારનાનાં અટે  
નાખીએ, પડા વિન્દું વાંચિતત્વ કરતાયું છે.

મૈધાડીનું માત્રભ વૃત્તપત્રજાર્ય મારે કેરળનું જંબલેસનું કેરનું  
કે હૃત્રાજ કર્યું છે. કોમળી પાણી વૃત્તપત્રની બાડિયની વાંચા વાતાવરણનું  
વિરાસાયું કેરળનું વિન્દું વાંચિતત્વ તો કૃપદ્ર છે. મૈધાડીમાં બાડિયની  
નિબાર્ગાંક રાખું હુંની. ને ઉપરંત વાતાવરણ વાતે જીમાણ વ્યાધીની ઊર્દી નિબાર્ગાં  
દુટી. વીરની વૃત્તપત્રનું લોનું પાણું - લોકઘડતરનું - વાંલાવા મારે કે  
વોંચયતમનું એન્ડિત ગાંધી છે. જો પાણાની મૈધાડીની જામગીરીની જામગીરા  
કુર્બા મારે પડા જધી જામગીરી પ્રાણ છે. કોમળાંદી જ કૃવાય. 'પરિલ્લમડા',  
'ચીકાવમાં', 'સ્થાંલેલાં', 'સ્થાંલેલાના બ્ઝૂર' ઎રી ચોડી પુસ્તકોમાં જો  
જામગીરી વાપડી પાણી વાતી છે, પડા કું કેરળીં જામગીરી - લેખક નામ  
નિબાર્ગી પડા - 'બાંદ્રાયુ' કરીં પગીનાં પાણાંમાં દરાવેલી પડી દીવાની  
જીલ્લાય છે. વૃત્તપત્રનાં પાણાની જડાર, જ્યંતંગ રૂપે પ્રત્યેસું ઘઢેલી 'પંચ  
વરસનાં પંચીડાં' કરીની તથા વિરિશ દીતદુષાસંધીની જામગીરી પડા  
પગડારના લોકબિંડાના ડલ્યની જ નીપજ ગાંધી વીનું છે.

મૈધાડીના પગડારન્યાં ગીરું પાણું ન વૃત્તપત્રમાં પાણ પર રહ્યું  
ઘઢેલી વાર્તાન્યાંથાં જામગીરી. લેટ્યુક્સન્ડ નરીંડી જાપણ મારે  
લજાયેલી નવતરણથાંજાના જ્ઞામાં જ્ઞમાયેલા ઘરી કાઉં કે કેમ તે ફર્જ છે.  
જો જામગીરી પગડારન્યની જીધી નીપજ ન દીધી વીને ખુલાકી જાડિયા.  
દીધીની જ કરવાની કર્યું. (પગડારન્ય જ્ઞામે કર્યું જાંસંદ્ર દીવાનું લાંબા  
જ કૃવાય. જો મૈધાડીના લોકબિંડના જંસાંદ્રન કાર્યની લાગ છે.)  
પરંતુ જીમાં પગડારન્યે વીરની પણ જાપેલા જંસંદ્ર જી કર્યું ખુલાય પાડાયો  
કૃદી વીની વાચ્ચા ઘરી કાઉં જરી. નવતરણનું હૃત્તાવાર લાંબાનું, નાડીનું  
લાંબાનું, જીમાં વાચ્ચાના જલલાયોંની લાગ લજવણી વરીએ. પડા  
જ્ઞામાં મૈધાડીના ખુલાકાની લકુમાં તેવી મેરદીની જી વીમણી  
જાર્ગાંધારીની જી મર્યાદા છે તેવી પગડારન્યના ખુલાયમાં જપાની દીવાની  
ચુતાવળ ન કરવી જીએબી. "રાજકીય પગડારન્યથી દૂર જણીને પડા  
મારી ખુલાસ કરી વિન્દું બાડિયન્યાંન તરી જાડી કૌન તેમ કું માનતાં

"तथा"- मेंदारी तो या निवैदनी पड़ा लक्षणः तीव्रा है कुं ध. मैंदारीमें पौत्राणा समय वर्ते वर्तमान प्रतीति है जाट निकायल है जाप है, जैसी किंतु इसका है जाप है को पश्चात्यवनी है का नपी पड़ा अवलाकान वर्त्तु है, पश्चात्यवनी वाची वैमने जैसी वाचनार वर्त्तु है. वैमना वाकुपनी है, विकापता वर्ते मर्यादा या अवलाकानी नीपर है.

अर्थे मेंदारीना पश्चात्यवनी पदु पदु शुक्त्य वापी वैमने इक्षाराम है साध वर्ते बुनीलाल व. वा. वा. वा. पश्चात्यवनी वर्तमाना वाकुपता वर्त्त्यार गायारी है वारु तेरे वांगी वाचप है को विचारण छुं है. इक्षाराम है साध वर्ते बु. व. वा. वा. वा. वीसराध गाया है, मैंदारी वार्ते पड़ा गुंत रुद्या है. वैमना वाकुपनी वा विकुंभिता वार्त्तनार तत्त्व पश्चात्यवनी ज्ञात ए वार्त्तु नीदहै. मेंदारीनी इतनी है ज्ञातरी तेलगनी कार्डी घडापी है पौत्री दूजी लड़ी वाचनारी वाचनाम; प्रवेष्या हुगा ते "वीरानी पीडार", जैवा वैमना तीव्रा तथा "डीकीमानी वारी", वा. "कुरजावीनी उच्चावी", जैवी वैमनी रथा. दूतको लताव है. हुं लीक्षमाकुपसंदीधन के हुं वाकुपवर्त्तन के हुं वौली-वौली लीज पश्चात्यवनी वीर्यों वर्ते, वीर्यों है वैमन दकुं हुं वर्दारे व्याचुं दीवानी वांलव है वर्ते वैनिकुड फ्रेस्टरु तुं है तेम "पश्चात्यवना धम्भाकामः पड़ा वाकुपत्तारनी छाई वीकुं वांतरिक वैडांत मेंदारी अवावी वाड्या", है को पड़ा वैमनी वाकुपत्तार नीडीनी है छली अग्रग्रुपडी उली छाय है ते जावी वापी है.

मेंदारीनां तेरां रूप वर्ते दैरेक दृपनां तेरां पावनः? लौड्जुले वार्ते गर्वीला डीव, लौड्जमाकुपनी प्रभर वांकोंदक, डगलालंद गंधीनी छाल उत्तरनार गद्यवामी, मैदीनी डीलावीने जडी वाखी तीव्रा वायड वर्ते वडता, वान्य लापावीना वावीनम व्यानुवादक वर्ते वृपांतरकार, वामान्य व्यानादकी वार्ते जरीने तंगीपद बुद्धीनी मजल व्यरुत्तरनार जीर्त पश्चात्य, व्यदालतमां वापदाजु भिरज्जटीनी वांख लीनी उरनार वान्यावाडी, दीराद रैशानी मारामानी उरनार, डार्दीनसर वान वाठियावाडी लरतना वाहन वीरवामेन. व्यवर्व्यपक्षम गूंथाद न

યોગવન ઘર ગઢેલા ક્ષા બધા મેદાળીઓમાંથી ડોની વાત ઉરીએ?

જુદાતે - જાસ ડોને બ્ઝેના મેદાળીને હેચુપડાયે વધાયા,  
તેમનો. પર લાઇન્યુકન વ્યાદરનો ક્લિનિક ડોને નેનું જીઝ ડોને ટેન્ડ, એફ,  
પ્રાડાર કે લીડ્યુલીયની ભાગનમાં જન્યું નથી. પડો વ્યાવી છાર્ફાર  
લોભપ્રિયતાને ડાબડો મેદાળીને ઘડું રૂઢસાન ઘડું છે. મેદાળી વિકી  
ને લયાંયું, ડ્રેનાયું છે તેમાં ઘડી વખત વ્યક્તિભાવનું પ્રમાણ વિકીષ  
કુચ છે. મેદાળી જીવા મૌરા ગાળા બાર્ફાનું રૂઢ્યાંદ્રન વ્યાતિશાય કર્યા  
દોબડો ઘડું આઈએ. મેદાળી ડાગળનો કોણાંથી ગોર્બી નથી, કાં  
રાયનું ઝોંચું છે તેથી વ્યેમને લડલડાર જણતી વ્યાગમાં કુમી દેવામાં કર્યું  
અર્જમ નથી.

જ્ઞાવા વ્યાત્યંત વ્યોગબી ક્ષાને લાકુનું પ્રતિભાવંતના પ્રશ્નારસ્તવનું  
નોંધલેખકા ડરતી વખતે તસુમાં કાલદું જીએથો કે મેદાળી મુલ્લૂત ના  
પ્રકાર છે. મેદાળી વ્યાશુબન પ્રકાર રહ્યા. વ્યાખ્યારી ડામના નડાદાના  
ડાબડો ક વ્યારટું વિષુલ વ્યાડિયસર્જન છાડ્ય જન્યું. મેદાળી પ્રકાર ન  
કુટીત ની વ્યાડિય ક્ષાને બંંકીદિન જન્યે ઝીંગી તેમનું પ્રદાન ઘડું વ્યોધું  
ઘણું કુટીત.

નંદી તરીકેની પીતાની જવાબદારી ક્ષાને પગની પ્રતિષ્ઠાની  
અનુકરણી મેદાળી બસીના બિયાધની જેમ જરતા હુતા. જ્રા ક્ષારથી ક્ષારનચુકદ્યો  
ડોને વર્તિને વ્યાશ્યાય થયો હુચ્ચ કે ડોને વિરોધ કે જુદાની વ્યાવી  
તો રેખ્યો જોઈ ક કંઈ ક્ષાને પ્રલિદુ ડોને રંપતા.

મૈધાડીલાઈ નિર્વાચિત રૂપારે જુગાર જીતાય છે ત્યારે ત્યારે જોમળી સ્થાનિકીય કોણની વાર્ષિક વૈધાયિકીની એ વિચાર ચાપ છે; નોંદિની સ્થાનિકીય નાનાંદનનમાં, જોમળી કરેલી પર્સીલ વારે પાચો પૂરવાના ડાર્થની એ પ્રકાશિત ચાપ છે. કાપવા ની ડાર્થની કુદુરતે બડીલા કાજાન મીઠાશ વાને ઉલ્લભાર્યાં હંડની ઉલ્લેખ ચાપ છે; પડા એ સ્થાનિકીય કાર્ય, વંશોદન વાને ગાયકું પણ પણારત્વના કુંગામાં કરેલી અભૂતય વાને અનન્ય વૈધાયિકી માટે વીકાલાઈ જતે લાગે છે. સ્થાનિકીય કોણી નિયમાં નિયમિતી નાનાંદન વાને પણ પણારત્વ - કોણી વીમળી બિસ્ટ્રી વાને વૈધાયિકી ફસ્ટ્યે વંગુલિતિંદ્રાં કરવાનું એ વાને તેજમાં એટા ગંધું છે.

ઝાણા ગુજરાતી પણારત્વની મીરા લાગાની પરિસ્થિતા તેમજ લાયાવરની લાઢા પ્રાર્થિત એસ્ટ્રોબાઓદ્દું - કુદુરતી છે. 'એસ્ટ્રોબાઓદ્દું' ના તંગીમંડળી ગુજરાતી લાખામાં પર્સીલી એ વાર કે શેખીલી વડી દાખલ કરી કોણું ક્યાંચું મૂલ્ય ક્યાંચું સ્થાનિકીય નાનાંદન વિષય. પડા રધાએ નિવ્યાર કરીએ કે દલપત - નર્મદાના વ્યમય કુદુરતી ગુજરાતીમાં 'ગદ્દ' કરી કાડાય વીંઠી કાંઈ વસ્તુજુ નકૃતી ત્યારી, ધોડા એ દાયડાયાંમાં 'એસ્ટ્રોબાઓદ્દું'ના પગડાએ, એ ગુજરાતી ગદ્દનું ગાંદેઠાં કાંઈ જરૂર વાંચાની પુસ્તકી છે. ગુજરાતી ગદ્દની અડીડી દુરકાડાની દુડીનું જનાવી દૂવામાં મૈધાડીલાઈની જીમવંતી, સાલ્યાદીભરી, તાકયા તીર કેવી વેદા કોને તથપદી દૂવાની કાનડી કલાણ વાને કડાની જાગીની ફાળી નાનોસ્સુની નથી. મૈધાડીલાઈના તંગીઠેણી કુદ્દા, રાષ્ટ્રકારીય કાંદીલની વાંચી, 'કાંબીલાં' ના કરાડી કુદુરતાની વિષયા કે જન્માદી કામાદી રની કરુંણાત્ત તરફ નજર કરી, તો કો કાર્યમાં કરેલી દુધીની કરી વાપરની કે "દલમ મૈધાડીલાઈની છે." એડ કાણાયાંદી, વાક્યામાં પડા કોના લખનારની પ્રતિસ્થા વાણિ કરી કાઢની નાની:

પણારત્વના સ્થાનિકીય નીચેના તથી કુદુરતાની રૂતાં : "દર્દી લાયાડાનાં કોપડીનું - સ્થાનિકીય નીચેના તથી કોણી વીર હંદાની, કોણી માર્ગકતાની નવી ધાર વ્યક્તા." છાપાનું તેખનજારી દલમની બુઢી કરી નાની હી વીંઠી નાની વીંઠી પાડી જનાયી છે.

मैदाणीलाई को द्वितीय व्याकुल्यकर्ता पश्चात् तयार होता है।  
पश्चात्त्वने व्याकुल्यर्थी कंगवारुं वौमानुं श्वेतं तो वौमनी दुपाति दरम्पात  
ए कंकातः ॥ अदृष्ट एव शूद्रयुं इतुं ॥

पश्चात्त्व के मैदाणीलाई भवे डेवल व्यासिंग- विलास  
नहीं, पश्च शुवनकार्य- भिकान इतुं । मैदाणीलाई ना विजत्त्वामः  
व्याकुल्यकार व्यापे पश्चात् वौवां व्यत्यग्यत्वा पासां इतां ए नहीं । तैथी  
ए, तैभना व्याकुल्यकर्ता प्रधानशुद्धात्यापड़ मानवता व्यापे व्यामाप- तैभना  
पश्चात्त्वमां पश्च व्यापे इकावी प्रधावी उठे हैं । श्यार्दृयार्द वौमधी  
मानवता के द्विजशति भैरव है, व्यरस्थायी मानवमूल्यानां दृश्य यती  
व्याकुल्यपां है, त्यारेत्यारे तैभधी निलीड जनीने उडाए उडावी है । इस  
का निलीडना डेवल लोगना डापनी नहीं है । वौनी पाछव तो  
कुछुमधी पश्च भौमण वौपुं दृद्य बैठतुं इतुं । वौपुं नी भौमण व्यापे व्यंगै  
नशील दृद्य मैदाणीलाई पासी इतुं के नानामां नानो जनाव के आप  
समान्य लोगना व्यामावार पश्च वौमना लोगडीतंशना तार झडाझडावी  
है ।

स्वाक्षिणी ईम पश्चात्त्वामां पश्च मैदाणीलाई 'माडाकार'  
तो व्यापारी इता । नानाक्षरजा 'न्यूज' ने पश्च तैबों के माडासाई नी  
स्वाक्षरकीचै ए व्यासता । पश्चात्त्वनी काक्षी व्यनक्षनारी भृत्ये वौमने  
लारे उडी नश्वर इती । स्तीलस भृत्य ने जांडीजांडी प्रस्याक्षरेत, प्रभना  
व्यरस्थायी विव्यारलावानी उवेली डेवल झाँडिङ व्यावेशीनी ए लड़ा,  
व्यवत्त्वा तुलनाक्षिणी फूलन डरी उनैशना शूद्रवानी ए व्यमालीता- या  
बदांही व्यावेशा । मारी ताखी ए उडाए पडेल वार्ताक्षिण्डु ने 'वैकान' उं  
नाम व्याप्तुं है ।

मैदाणीलाई दृष्टप्रमां मुंगाई व्यावेशा । मारी ताखी ए उडाए  
पडेल वार्ताक्षिण्डु 'द्वृद्यवतां धूर' के वौमने व्याप्ति । परी तैभडों लभीला  
पश्चामां मैदाणीलाई तैभना पश्चात्त्वना व्याकुल्यकर्ता व्याकुल्यकर्ता व्यापे भय है ।

"या वार्ताक्षीमां लेखड, तुं कुमेशां जैने मारै झंयुं छुं त  
दृतीतां जैने उडाए व्याकुल्यां हे पश्च व्यावीपरी व्यंका तो वौमनी निलडुल

કદુતામૂડન ઘર્ણાનુઝન તીવ્ચે ને કુલાલી વાટાકુર્ંપાલો સંદિત માનવતા છે.  
જશીક, જી પ્રકારના પગડારન્યમાં લાઈ ગર્ડિયા કાર્ય પડયા છે તે કોમળામાં  
કાલી વાતાલી ભરાયાની કાર્યત - જાંડે દુંભા કર્યા દેશે કું કુમ વ્યે  
વિષયારે દ્રુત બુનું છું. કારધાડે કું નો પેલી માનવતા કંસારમાંના કંઈ  
બારાનન્દસા માડાલી પ્રત્યેની વાટાલ્ય દાર્શનિકની કૌલતી માનવતાના વાંશાંનું  
કાપડા પગડારન્યમાં ખૂન થનું મેટું છું કાપડા વાલાદ્વારાંપલા રીતો પાર  
નથી. પારકા પર કુલિફાયોનું ઉક્ખાબડા વી કાપડા ઝોનાડ લની ગયો  
છે. «કાર્ય» ને «ખરાલ» કે લે કૌંકડામાં ર પુંફેડ નાનીમોટી બાળતની  
વડુંચયાનું કાપડાનું કાર્ય પર પડ્યું છે. એ વસ્તુ કાપડા શુવનદ્વિષ ની  
વિર્ઘાતક છે!»

દ્વારી વાપક માનવતા કને વસ્તુભાવ વી જ સાચા,  
વાટાલ્ય દાર્શનિક વિમા પગડારનાં ડવચ દુનાં.